

જતન અને તક લક્ષી આયોજન



વધુ બાળ સંભાળ, વધુ પસંદગીઓ

નાના બાળકો ધરાવતા પરિવારો માટે, બાળ સંભાળ માટેની પહોંચ અત્યંત મહત્વની છે. જો વધુ માબાપોને પોસાય તેવી બાળ સંભાળ મળે, તો તેઓ કામ પર પાછા જવાનું પસંદ કરી શકે. આ બજેટમાં, વધુ પરિવારો માટે બાળ સંભાળ માટેની પહોંચ વધારવા અને તેમને માટે એ વધુ પોષણક્ષમ બનાવવા ઓન્ટેરિઓ રાજ્ય આવતા ત્રણ વર્ષના ગાળા માટે 2.2 બિલિયન ડોલરથી વધુનું મૂડીરોકાણ કરી રહ્યું છે.



શાળા પહેલાની- અને પછીની- જોગવાઈ

મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમો પૂરા પાડવાની જરૂરિયાત શાળા બોર્ડ પર લાગુ કરી 12 વર્ષ સુધીની વયના બાળકોવાળા પરિવારોને શાળા પહેલાના - અને પછીના - બાળસંભાળ કાર્યક્રમોમાં વધુ સારી રીતે પ્રવેશ અપાવી રહ્યું છે.



મફત શાળાપૂર્વ બાળસંભાળની જોગવાઈ

કિન્ડરગાર્ટનમાં જવાલાયક થાય ત્યાં સુધી અઢી વર્ષના બાળકો માટે મફત શાળાપૂર્વ બાળસંભાળની જોગવાઈ કરી પરિવારોને વધુ પરવડી શકે તેવી ગુણવત્તાયુક્ત બાળસેવા પૂરી પાડી રહ્યું છે, જે પરિવારોને પૂર્ણ દિવસના કિન્ડરગાર્ટનથી પણ મળતી બચતમાં વૃદ્ધિ કરે છે.



બાળસેવાને લગતા વધુ સ્થળોની જોગવાઈ

1,00,000 થી વધુ બચ્ચાઓને ઉચ્ચ-ગુણવત્તાવાળી બાળસેવામાં પ્રવેશ અપાવવા માટે મદદ કરી રહ્યું છે-અને પરિવારોને બધી નવી જગ્યાઓના 60 ટકા માટે સબસિડી આપી વધારાની નાણાકીય સહાયની ઓફર કરી રહ્યું છે.

મફત શાળાપૂર્વ જોગવાઈ માટે

ઓન્ટેરિઓ રાજ્ય:

- સપ્ટેમ્બર 2020થી શરૂ થતી, કિન્ડરગાર્ટનમાં જવાલાયક થાય ત્યાં સુધી અઢી વર્ષના બાળકો માટે તદ્દન મફત શાળાપૂર્વની બાળસેવાની જોગવાઈ કરી પરિવારોને પોતાના પ્રત્યેક બાળક દીઠ સરેરાશ 17,000 ડોલરની બચત આપી રહ્યું છે.
- પુરતી ક્ષમતા હોવાનું સુનિશ્ચિત કરવા બાળસેવાને લગતી 10,000 પૂર્વશાળા માટેની જગ્યાઓ અને 4,000 સમુદાય-આધારિત જગ્યાઓ તૈયાર કરવા આવતા છ વર્ષો દરમિયાન 534 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કરી રહ્યું છે.
- સમગ્ર પ્રાંતમાં 45,000 નવા લાઇસન્સ ધરાવતા બાળસેવા કેન્દ્રો તૈયાર કરવા મૂડી ભંડોળમાં આવતા પાંચ વર્ષો દરમિયાન 1.6 બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરી રહ્યું છે.

બાળ સંભાળ પ્રણાલીમાં પ્રવેશનો વધારો અને તેના સુધારા માટે

ઓન્ટેરિઓ રાજ્ય:

- બાળસેવામાં પ્રવેશ વધારવા અને ઓન્ટેરિઓના વધુ પરિવારોની સક્ષમતામાં વધારો કરવા અગામી ત્રણ વર્ષો દરમિયાન વધારાના 2.2 બિલિયન ડોલર છુટા કરી રહ્યું છે.
- પ્રથમ નાગરિકોની વસ્તીમાં 1,800 થી વધુ બાળકો અને તેમના પરિવારોને સુધારેલી, પોતાની સંસ્કૃતિ સાથે મેળ પડે તેવી બાળસેવા, અને બાળક અને કુટુંબને લગતા કાર્યક્રમો પૂરા પાડી રહ્યું છે.
- નવા અને હાલના અનામત બાળસેવા કાર્યક્રમો માટે વધારાના ભંડોળ રૂપે આગામી ત્રણ વર્ષો દરમિયાન પ્રથમ નાગરિકોની વસ્તીને 40 મીલીઅન ડોલર પુરા પાડી રહ્યું છે.
- બાળસેવામાં નિષ્ણાત વ્યવસાયીઓના વેતનમાં વધારો કરીને અને રોજગાર, તેમાં ટકી રહેવા તથા વ્યવસાયિક વિકાસ માટે મૂડીરોકાણ કરી તેમને સહાય કરી રહ્યું છે.

હાલના પ્રવૃત્ત અને જ્ઞાની શિક્ષકો દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી બાળસેવા પૂરી પડવાનું ચાલુ રહેશે તેવી બાંહેધરી આપવા એક પગારમાળખું વિકસાવી રહ્યું છે.